

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦
તા.૦૩/૦૮/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૦૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૦ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૮૬૪ લીટર દેશી દારૂ, ૭૨૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૮ બિયર ટીન, ૧ મોટર સાયકલ, ૧ રિક્ષા, ૧ છોટા હાથી અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૩૬ કેસ કરી ૨૨૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૦,૨૯,૯૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૦૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૭૦૩/૧૮

વાડજ: સચિન વિનોદચંન્દ્ર દાણી (રહે. કૃષ્ણ ગોકુળ એપાર્ટમેન્ટ રસમધુર સ્વીટ હોમ પાછળ રામાપીરનો ટેકરો નવા વાડજ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨/૮/૧૮ કલાક ૧/૦૦ થી કલાક ૪/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી ઘરમાંથી જરૂરી દસ્તાવેજ તેમજ સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ઘડીયાળ કિંમત રૂપિયા ૮૦૦/- અને રોકડ રૂપિયા ૭૩૨૦૦/- મળી કુલ રૂપિયા ૯૯,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.પી.પરમાર ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૭૦૪/૧૮

ચાંદખેડા: રામકુમાર સુરેન્દ્રસિંહ પરીહાર (રહે. ડાયમંડ ટાવર સેવી સોલારીસ પાસે ચાંદખેડા) એ તા.૨/૮/૧૮ સવારના ૧૧/૪૦ વાગે ચાંદખેડા વિસત ગાંધીનગર હાઇવે પિતેશ્વર મહાદેવના મંદિર આગળ પાર્ક કરેલ પોતાની કારના દરવાજાનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારમાંથી એન્ડોસ્કોપી મશીન કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦/- તથા અગત્યના દસ્તાવેજો સાથેની શુટકેશ ચોરી કરી લઈ ગઈ હતી. આ અંગેની ફરીયાદ રામકુમાર પરીહારે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.સોલંકી ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૭૦૫/૧૮

જીઆઈડીસી વટવા: સંજયભાઈ નાગરભાઈ પટેલ ઉ.વ.૫૪ (રહે. હરીઓમનગર સોસાયટી જીવીબા સ્કૂલ પાસે ઘોડાસર) ને તા.૧/૯/૧૮ સવારના ૧૦/૩૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન જીઆઈડીસી વટવા ફેઝ-૧ માં આવેલ મહેન્દ્રા કોટક બેંકમાં ત્રણ અજાણ્યા પુરૂષોએ સંજયભાઈને છરી બતાવી ૨૦૦૦ ના દરની કુલ ૩૬ ચલણી નોટ મળી કુલ રૂપિયા ૭૨,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સંજયભાઈ પટેલે જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એન.વાઘેલા ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૭૦૬/૧૮

શાહીબાગ: સોનલબહેન વા/ઓ ભરતભાઈ પટણી (ઉ.વ.૩૬) (રહે. પટણી સંજોગનગર છેલ્લા બસ સ્ટેન્ડ મેઘાણીનગર) તા.૨/૯/૧૮ રાતના ૯/૪૦ વાગ્યાના સુમારે શનીદેવ મંદીર સામેથી પતિ સાથે એક્ટીવા પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સોનલબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સોનલબહેને શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એ.કે.પટેલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૭૦૭/૧૮

શાહીબાગ: તા.૨/૯/૧૮ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે કેન્સર હોસ્પિટલ ગેટ નંબર-૬ સામે ટ્રક નંબર જીજે ૧ બીવી ૨૦૧૮ ના ચાલકે ટ્રક પુરૂષો અને બેદરકારીથી ચલાવી ૪૫ વર્ષના આશરાની અજાણી સ્ત્રીને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા અજાણી સ્ત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે શાહીબાગ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.પી.મકવાણા ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૭૦૮/૧૮

કૃષ્ણનગર: જીતેન્દ્રભાઈ ઉદલસિંહ સોરચીયા (ઉ.વ.૪૦) (રહે. પઠાણની ચાલી તળાવ પાસે સૈજપુર) તા.૩૦/૮/૧૮ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાયમસ ઉપર રસોઈ બનાવતા હતા ત્યારે પ્રાયમસ ફાટતા જીતેન્દ્રભાઈ દાઝી ગયા હતા. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨/૯/૧૮ બપોરના ૨/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ગોવિંદસિંહ તખતસિંહ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૭૦૯/૧૮

રામોલ: જીવણલાલ સુરમલજી ખટીક (ઉ.વ.૬૦) (રહે. શિવપાર્ક સોસાયટી રામ રાજ્યનગર ઓઢવ) એ બિમારીથી કંટાળી તા.૧/૯/૧૮ કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન રાતના ૮/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ભીખુભાઈ ભલાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.